

## Acknowledgement

### નિવેદન

શ્રી અરવિંદ ઘોષ ( ઇ.સ. ૧૯૧૨- ૧૯૬૦) ની સર્વ-ચિંતક તરીકેની પ્રતિભાનો અને તેમના અદ્યાત્મ દર્શનનો ભારતના સ્વાતંત્ર્યોત્તરકાળના જીવન પર એક ગહાનાપાત્ર પ્રભાવ પડેલો મેં ઈ શકાય છે. ગુજરાતના સાંસ્કૃતિક જીવન પર આ પ્રભાવ સુસ્પષ્ટ પ્રતીત થાય છે. ગુજરાતી સાહિત્યના ગાંધીયુગીન ઘડતર પરિબળોની સમાંતરે શ્રી અરવિંદ અને રવીન્દ્રનાથ ટાગોરનો પ્રભાવ આપણે મેં ઈ શકીએ છીએ. અંબાલાલ પુરાણી, પૂર્ણલાલ, સુન્દરમ જેવા ગુજરાતના સાહિત્યકારોએ શ્રી અરવિંદ ચરણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરીને સાહિત્યને અદ્યાત્મનું વાહન બનાવ્યું. એટલું જ નહિ, ગુજરાતના ગહાનાપાત્ર સાહિત્યકારો પર શ્રી અરવિંદ દર્શનનો સુસ્પષ્ટ પ્રભાવ મેંવા મળે છે. આમ, રૂપે રૂપે પ્રગટતા, પ્રવહતા ગુજરાતી સાહિત્યમાં શ્રી અરવિંદ દર્શન પ્રેરિત એક વિશિષ્ટ સાહિત્યધારા પણ પ્રગટી છે. આ ધારાનાં આપણે ત્યાં છૂટાછવાયા અભ્યાસો જરૂર થયા છે. પરંતુ એમાં હજુ ઘણુંબધું કરવાનું બાકી રહ્યું છે. અદ્યાત્મ અને સાહિત્યના સમન્વય પરત્વે અભિમુખ અભ્યાસીઓને આવાં અદ્યતનનાં આકર્ષી પણ રહ્યાં છે. એમાંથી પ્રેરણા લઈને શ્રી અરવિંદ વિરચિત 'સાવિત્રી' મહાકાવ્યના ગુજરાતી અનુવાદોના અદ્યતનનો પીએચ.ડીની હુપાઈ નિમિત્તે સંશોધન વિષય તરીકે સ્વીકાર કર્યો. મૂળકૃતિ અને તેના અનુવાદોની સર્જનાતા-નિષ્કર્જનાતાની વિચારણા કરતું આણું તુલનાત્મક અદ્યતન અધ્યાપિપર્યંત આપણે ત્યાં થયું નથી. આ દિશામાં પ્રથમ જ વાર મારો આ નમ્ર પ્રયાગ છે.

પૂર્વ અને પશ્ચિમના મહાકાવ્યોની પરંપરાના હાકૂબટ સમન્વય તેમજ શ્રી અરવિંદ દર્શનના સર્વોત્તમ આધિકાર

લોખે 'સાવિત્રી' વિષયસાહિત્યની એક વિસફીણ કલાહતિ બની રહી છે. આવી બહુપરિમાણી મહાકાવ્ય રચનાનો અનુવાદ કરવો એ એક પડકારરૂપ કાર્ય હોવા છતાં એના વિષયની અનોક ભાષાઓમાં અનુવાદો થયા છે, આ એક શુભઘટના છે. ગુજરાતીમાં કાળાનુક્રમો એતાં સુન્દરમ્, અંબાલાલા પુરાણી અને સુન્દરમ્ ના અનુવાદ મુખ્ય છે. અનુવાદના અર્થસંક્રમણ-ગત અને ભાષાકર્મગત પ્રશ્નો સાથે અનુવાદમાં પ્રેરાયેલી ડુદીડુદી સર્જક એતના એ કેવું કામ પાર પાડ્યું છે એનું અદ્યતન કરવાનો પ્રસ્તુત મહાનિબંધનો ઉપક્રમ છે. આ ઉપરાંત શ્રી અરવિંદ દર્શનથી ગુજરાતી ભાષા અને સાહિત્યને શી ઉપલબ્ધિ થઈ છે તેની તપાસ પણ અત્રે કરવામાં આવી છે. આ માટે પ્રસ્તુત મહાનિબંધને ચાર પ્રકરણોમાં વિભાજિત કર્યો છે.

શ્રી અરવિંદ અને 'સાવિત્રી' શીર્ષક ધરાવતા પ્રથમ પ્રકરણમાં શ્રી અરવિંદના બહુપાર્શ્વી વ્યક્તિત્વના મુખ્યત્વે ત્રણ પાસાંઓનો સંક્ષિપ્ત પરિચય કરાવ્યો છે. સૌપ્રથમ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શ્રી અરવિંદના વિશિષ્ટ પ્રદાનની વિચારણા કરવામાં આવી છે. શ્રી અરવિંદનું યોગી તરીકેનું અદ્યતન જીવન તો બાહ્ય સપાટી પરથી એક મૂલવી શકાય એમ ન હોવા છતાં શ્રી અરવિંદે પોતાની યોગસાધનાના જે મહત્વનાં સ્થિત્યંતરોનો નિર્દેશ કર્યો છે તેને આધારે એમના અદ્યતન પુરુષ તરીકેના વ્યક્તિત્વનો ખ્યાલ આપવામાં આવ્યો છે. ત્યારબાદ શ્રી અરવિંદની બહુમુખી સાહિત્યિક પ્રતિભાનો સંક્ષિપ્તમાં સમીક્ષાત્મક પરિચય આપવામાં આવ્યો છે. આની સાથે 'સાવિત્રી'ના સૂળ-સ્રોત, 'સાવિત્રી'લેખનનું શ્રી અરવિંદનું પ્રયોજન, એની સર્જન-પ્રક્રિયા વગેરેનો નિર્દેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ 'સાવિત્રી'ની સંરચના, વિષયવસ્તુ અને એનાં ભાષાકર્મની તલાવગાહી વિચારણા કરવામાં આવી છે. એ પછી 'સાવિત્રી'ના આદ્યતનિક, સાહિત્યિક મહત્વનો વિચાર કરીને એના મૂલ્યાંકનના સંબંધક અભિગમ પરત્વે સંકેત કરવામાં આવ્યો છે. અંતે પ્રસ્તુત

હતિના વિદ્યાની વિવિધ ભાષાઓમાં થયેલા અનુવાદોનો નિર્દેશ કરીને ગુજરાતી ભાષામાં અદ્યોપિપર્યંત થયેલા 'સાવિત્રી'ના અનુવાદોના નાના મોટા તમામ પ્રયાનોની ચર્ચા કરવામાં આવી છે. તેમજ એ નિમિત્ત ઉપસ્થિત થતા પ્રશ્નોનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે.

'સાવિત્રી'નો ગુજરાતી અર્થ અનુવાદ' નામના બીજા પ્રકરણમાં આરંભે કાલ્પહતિના અનુવાદની સમસ્યાઓના પરિપ્રેક્ષ્યમાં પૂખ્તલાલે આપેલા 'સાવિત્રી'ના અનુવાદનું તલાવગાહી અદ્યતન કરવામાં આવ્યું છે. આરંભે પૂખ્તલાલના સાહિત્યિક પ્રદાન અને તેમાંથી અનુવાદક તરીકેના તેમના પાસાંને ધ્યાનમાં રાખીને એમનો પરિચય આપવામાં આવ્યો છે. એ પછી એમના અનુવાદની પ્રથમ અર્થસંક્રમણ અને ત્યારબાદ ભાષાકર્મની દૃષ્ટિએ વિચારણા કરવામાં આવી છે. -

'સાવિત્રી'ના ગુજરાતી અર્થ અનુવાદો' નામના ત્રીજા પ્રકરણમાં અનુક્રમે અંબાલાલ પુરાહી, સુન્દરમ્, ચંદ્રવદન મહેતા અને જતીન્દ્રે આચાર્યએ 'સાવિત્રી'ના કરેલા અર્થ અનુવાદોની વિચારણા કરવામાં આવી છે. એ માટે પ્રસ્તુત પ્રકરણને ચાર પેટાવિભાગોમાં વહેંચ્યું છે. આરંભે પ્રત્યેક અનુવાદકના સાહિત્યિક પ્રદાન અને અનુવાદક તરીકેના તેમના કાર્ય પરાવે સંકેત કરવામાં આવ્યો છે. એ પછી પ્રત્યેક અનુવાદનું અર્થસંક્રમણ અને ભાષાકર્મની દૃષ્ટિએ અદ્યતન કરવામાં આવ્યું છે.

'ઉપસંહાર' નામના ચોથા અને અંતિમ પ્રકરણમાં 'સાવિત્રી'ના અનુવાદના પ્રમુખ પ્રયાનોમાં મૂળ હતિના ભાવને અનુવાદમાં પ્રગટાવવાની અનુવાદકને મળેલી સર્જનતા અને અનુદિત હતિની પ્રાસાદિકતાનો વિચાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ 'સાવિત્રી'ની અનુવાદ પ્રવૃત્તિના અદ્યતનના સંઘણ પ્રયાનોમાં સૂક્ષ્મ અદ્યતનના નિષ્કર્ષો રજૂ કરવામાં આવ્યા છે. આ ૪ પ્રકરણમાં 'સાવિત્રી'ના અનુવાદો અને સ્ત્રી અરવિંદ - દર્શનના ગુજરાતના સૌન્દર્યિક પ્રવન પર પડેલા પ્રભાવની વિચારણા

કરવામાં આવી છે.

પ્રસ્તુત સંશોધનકાર્ય મારા માટે એક જીવનસાધના બની રહ્યું છે. એને સાધનાના એક ભાગરૂપે જ સ્વીકાર્યું છે. એટલે સાધનામાં જે સ્પૂળ, સૂઈમ, આંતર, બાહ્ય અવરોધો આવી શકે એ તમામ પ્રાપ્ત થયા છે. એ બધામાં શ્રદ્ધાપૂર્વક મંડવા રહેવાથી પાર પણ ઉતરાયું છે. માટે એનાથી મારો શ્રદ્ધા દેહ થઈ છે, સમજ સૂઈમ થઈ છે અને આ નવી દિશાનો શોષ જીવન સમર્પવાની પ્રેરણા પણ પ્રાપ્ત થઈ છે. પાંચ-સાઠપાંચ વર્ષના આ પરિશ્રમના સમાપન પ્રસંગે એક શિખર આરોહયાનો ભાવ થયો છે. આ શિખર પરથી વધારે ઊંચા, વધારે દુષ્કર શિખરો દ્રષ્ટિગોચર થઈ રહ્યાં છે. એ મને આમંત્રી રહ્યાં છે.

મારા આટલાને આવા આરોહણમાં અનેક સ્વપ્નનો માર્ગદર્શક, સાહાયક બની રહ્યા છે. એમના વગર આ કાર્ય આજે આ રીતે સાકાર થયું હોત કે કેમ એ એક સંવાલ છે. નીચે દર્શાવેલા સ્વપ્નનો અત્રે ખાસ ભાવપૂર્વક સ્મરું છું :

- \* આ વિદ્યાતાપના પ્રેરક, માર્ગદર્શક : ડૉ. સુભાષ દવે.
- \* આરંભથી આજપર્યંત આ શોધકાર્યમાં સતત મારી સાથે રહેનાર મારાં પરિવારજનો : પિતા : રમણલાલ પાંડક, માતા : પદ્માબહેન ; પત્ની જયના, પુત્રી પ્રિયા અને મહાનિર્બંધ માટે કાગળો હપલબંધ કરી આપનાર : બનેવી : વિજય પંડ્યા.
- \* પોંડિચેરી શ્રી અરવિંદ આશ્રમના સર્વપ્રી સરલા શર્મા, ફલાબહેન, સુરેન્દ્રભાઈ,
- \* સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. દિલાવરસિંહ મોમ ; સ.પ. યુનિ.ના ગુજરાતી અનુસ્નાતક વિભાગના મારા સાથી અધ્યાપક મિત્રો પ્રોફેસર જયંત ગાડીત, ડૉ. મહિલાલ હ. પટેલ, તેમજ અનુસ્નાતક સંસ્કૃત વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર ભક્તિનાથ શુક્લ,
- \* શ્રી અરવિંદ પરિવારના સભ્યો : જતીન્દ્ર આચાર્ય (દિંમતનગર), નટુભાઈ પંચાલ (વિદ્યાનગર) તેમજ


બાબુભાઈ પટેલ (વડોદરા)

- \* 'સાવિત્રી' માં પ્રયોજાયેલા ખ્રિસ્તી ધર્મના સંદર્ભોને સ્પષ્ટ કરનારા : ફાઇર ઈસુદાસ ક્વેલી (ગામડી, આર્હાઈ)
- \* શ્રી અરવિંદ સાધના કેન્દ્ર વલ્લભ વિદ્યાનગર અને સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રસ્તકાલયો.
- \* ઝેરોફી, પ્રિન્ટિંગ અને બાઈન્ડિંગ આદિ કાર્ય સાથે સંકળાયેલા મિત્રો..

મારી સાધનામાં પ્રત્યક્ષ, પરોક્ષ રૂપે સહાયભૂત થનાર આ અને આસિવાયની પણ તમામ વ્યક્તિઓ પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.

આ મહાનિબંધ પરિક્ષીત કાર્યાલયે યુનિવર્સિટીને સુપ્રત કરું છું.

૨૯ સપ્ટે. ૯૫.  
વડોદરા.



(પરમ પાઠક)